



The Baroda Rayon Corporation Ltd.

CIN L45100GJ1958PLC000892

P O Fatehnagar, Udhna, Surat 394 220

Tel : 0261-2899555

Email : admin@brcl.in

Website : www.brcl.in

August 14, 2025

To,
Department of Corporate Services,
BSE Limited
P. J. Towers, Dalal Street,
Mumbai – 400 001.

Sub – Newspaper Advertisement – Publication of Standalone Un-Audited Financial Results of the company for the quarter ended June 30, 2025.

Ref – BSE Scrip code – 500270

Dear Sir,

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, as amended, please find enclosed copies of newspapers advertisement [Financial Express (English) and Pratap Darpan (Gujarati)] edition which contains a Quick Response code and the details of the webpage where complete Standalone Un-Audited Financial Results for the quarter ended June 30, 2025 along with the Limited Review Report are accessible to the investors.

Request you to kindly take the same on your record.

Thanking you,

Yours faithfully,

For The Baroda Rayon Corporation Limited

Kunjai S Desai

**Kunjai Desai
Company Secretary**

Encl: As Above



Dudhsagar Dairy
India's Largest Co-operative Dairy
Mehsana District Co-operative Milk Producers' Union Ltd
Post Box No.1, Highway, Mehsana-384002 Phone:-02762-253201
Website: <http://www.dudhsagardairy.coop/tenders/>

E-Tender Notice

Tender ID	Work Description	Last Date
213622	Supply & Installation of Fire Detection & Firefighting System at Cattle Feed Plant- Jagudan and Ubkhal.	28/08/2025
213625	Supply of 40 Litre aluminum can with lids at DSN.	28/08/2025
213627	Supply of spares for Ice cream Cone machine at Manesar.	28/08/2025
213628	Supply of Caustic Soda Flakes, caustic soda lye and Nitric Acid at Mehana and at our CC's in Gujarat.	21/08/2025
213629	Supply of Uniform Cloth Suiting and Shirting at Mehana and Dharuhera.	28/08/2025
214553	Supply of Executive Diary and Gujarati- Hindi Calendar at Mehana.	28/08/2025
210847	Annual Rate Contract for Pur-Argon Welding of SS/MS304/316 Pipe and Fitting Fabrication (Labour Job) at Mehana.	28/08/2025
212969	Annual Rate Contract for Electric Motor Re-winding at Dharuhera.	28/08/2025
211190	Annual Rate Contract for refrigerated vehicle for stock transfer among Manesar, Dharuhera, Smriti & Nadaun.	28/08/2025

E-Tender Website: <https://tender.nprocure.com/>
For details refer tender document available on e-tender website. We regularly publish our RFQ's on website: <https://dudhsagar.nprocure.com/>
Date: 14/08/2025 I/C Managing Director

કેનરા બેંક Canara Bank

Canara Bank, Ghodasar- 2 Branch
Shop No. 1 to 6, Yash Commercial Complex, Opp. Jagdishnagar Society, Near Smruthi Mandir, Punil Nagar Crossing Road, Ghodasar, Ahmedabad

Annexure XXXV
Draft of Auction Sale Notice for Publication of Auction Sale Notice for publication in the Newspaper Ghodasar II (Branch)

The under mentioned persons are hereby informed that they have failed to pay off the liability in the loan accounts. Notices sent to them by Registered Post have been returned undelivered, to the Bank. They are therefore requested to pay off the liability and other charges and redeem the pledged securities on or before **22.08.2025** (date) failing which the said securities will be sold by the Bank in public auction at the cost of the borrower at the Bank's premises at Ghodasar A.M./P.M. on **22.08.2025** or On any other convenient date thereafter without further notice, at the absolute discretion of the Bank.

Sr. No.	Date of Loan	Loan Number	Name and address of the borrower
1	04.09.2024	164032951686	Mishrilal Kasaramji Dewasi 3, Mangaldeep Park, Vatva, Ahmedabad

NOTE: Amount outstanding should include all liabilities of the party other Gold Loans as well as any other loan/credit facility.
Date : 13.08.2025,
Place : Ahmedabad

Sr. Manager

કેનરા બેંક Canara Bank

Canara Bank, Thaltej Branch
Add- 101-102, Aayna complex, Hebatpur Road, Thaltej
Ahmedabad -380059

Annexure XXXV
Draft of Auction Sale Notice for Publication of Auction Sale Notice for publication in the Newspaper Thaltej (Branch)

The under mentioned persons are hereby informed that they have failed to pay off the liability in the loan accounts. Notices sent to them by Registered Post have been returned undelivered, to the Bank. They are therefore requested to pay off the liability and other charges and redeem the pledged securities on or before **22.08.2025** (date) failing which the said securities will be sold by the Bank in public auction at the cost of the borrower at the Bank's premises at Thaltej A.M./P.M. on **22.08.2025** or On any other convenient date thereafter without further notice, at the absolute discretion of the Bank.

Sr. No.	Date of Loan	Loan Number	Name and address of the borrower
1	11.04.2023	180169131482	Kevin Panchal, 702, Aashka Floret, Science city Road, Sola, Ahmedabad -380060

NOTE: Amount outstanding should include all liabilities of the party other Gold Loans as well as any other loan/credit facility.
Date : 13.08.2025,
Place : Ahmedabad

Sr. Manager

IDFC FIRST Bank Limited
(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)
CIN : L65110TN2014PLC097792
Registered Office : KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031.
Tel : +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr Account No.	Loan Account No.	Type of Loan	Name of Borrowers and Co-Borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice
1	19086252	Home Loan	1. Mr. Punabhai D Rathod 2. Mr. Bhavesh Punabhai Rathod	16.01.2025	INR 13,54,105.51/-

Property Address : All That Piece And Parcel Of Immovable Property, Premises of Plot No. 14 Paikae Southern Society Side Sited Property, Admeasuring 20 Fts. Length, 12 Fts. Width, i.e. 240 Sq. Mtrs. i.e. 26.66 Sq. Yards, Having Construction On Ground Floor & First Floor Admeasuring 44.58 Sq. Mtrs., Built Up Area, Alongwith Proportionate Undivided Share In Road, "aaspa Nagar Society", Developed Upon Land Situated In State: Gujarat, District: Surat, Sub-district & Taluka: Surat City, Moje: Dindoli, Bearing Revenue Survey No. 252/1-2, T.p. Scheme No. 40, P. No. 56, O.p. No. 56, Surat, Gujarat- 394210, And, **Bounded As: East:** Plot No. 13 **West:** 15 Ft. Margin **North:** Plot No. 14 **South:** 25ft. Road

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/-
Authorized Officer
IDFC First Bank Limited

Date : 14.08.2025 (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)
Place : Surat, Gujarat

IDFC FIRST Bank Limited
(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)
CIN : L65110TN2014PLC097792
Registered Office : KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031.
Tel : +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr Account No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice
1	108507552	Home Loan	1. Imranbhai Ismailbhai Malek 2. Malek Ismailbhai	12.07.2025	INR 5,45,641.00/-

Property Address : All That Piece And Parcel Of Gamtal Property No. 3/92, Area Admeasuring 1080 Sq. Ft., Situated At Village: Jalapura, Registration District & Sub-District: Padra, District: Vadodara, Gujarat-391430, And **Bounded As: East:** By Government Place **West:** By Public Road **North:** By House Of Ahmad Daji **South:** By House Of Gafurbhai Gulabbhai

Sr Account No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice
2	42232410	Home Loan	1. Rameshbhai Chandubhai Parmar 2. Shakuntalaben Parmar	31.07.2025	INR 6,07,464.06/-

Property Address : All That Piece And Parcel Of Non Agriculture Property In Mauje: Handod, Karjan, Vadodara, Lying Being Land Bearing Gram Panchayat Anukram No. 166, Property No. 41 Admeasuring 117.93 Sq. Mtrs., Paiki Eastern Side 1/2 Part Property No. 41/2 Admeasuring 58.97 Sq. Mtrs., At Registration District & Sub-district: Karjan & District: Vadodara, Gujarat-391240, And **Bounded As: North:** By Wado Of Turi **South:** By Raj Marg **East:** By Wado Of Govind Bhudar **West:** By Gabhan Paiki Gabhan Of Mulshankar Dalpatram Bhatt & Others

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/-
Authorized Officer
IDFC First Bank Limited

Date : 14.08.2025 (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)
Place : Vadodara, Gujarat

THE BARODA RAYON CORPORATION LIMITED
CIN – L45100GJ1958PLC000892
Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna,
Dist. Surat-394220
(T) 0261-2899555 | Email-admin@brcl.in | website-www.brcl.in

Standalone Un-Audited Financial Results for the Quarter ended June 30, 2025

The Board of Directors of the company, at their Meeting held on August 13, 2025 approved the Un-Audited Financial Results of the company for the quarter ended June 30, 2025. The results, along with Auditors Limited Review Report are also available on the Company's **w e b p a g e a t <http://brcl.in/UploadedFile/Reports/13082025134445173.pdf>** and website of the stock exchange i.e. BSE Limited at www.bseindia.com can also be accessed by scanning the QR Code.

For The Baroda Rayon Corporation Limited
Sd/- Damodarbhaj Patel
Date : 13-08-2025
Place : Surat.
Managing Director
DIN-00056513

Note: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (LODR) Regulations, 2015.

IDFC FIRST Bank Limited
(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN : L65110TN2014PLC097792
Registered Office : KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031.
Tel : +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr Account No.	Loan Account No.	Type of Loan	Name of borrowers and co-borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice
1	41490632	Loan Against Property	1. Ambalai Nagjibhai Mujeth 2. Dharmendra Ambalai Mujeth 3. Urmilaben Ambalai Mujeth	16.07.2025	INR 3,90,007.51/-

Property Address : All That Piece And Parcel Of Land Bearing Property No. 160, Land Area Admeasuring 610.50 Sq. Fts., Built Up Area Admeasuring 1140 Sq. Fts., Carpet Area Admeasuring 1026 Sq. Fts., Situated At Moje: Telod, Registration District & Sub-District: Amod, District: Bharuch, Gujarat-392110, And Bounded As: **East:** By Property Of Ajitbhansingh, **North:** By Chai, **West:** By Property Of Bharat Udesingh, **South:** By Public Road

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/-
Authorized Officer
IDFC First Bank Limited

Date : 14.08.2025 (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)
Place : Bharuch, Gujarat

IDFC FIRST Bank Limited
(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) | CIN : L65110TN2014PLC097792
Registered Office : KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031.
Tel : +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) The loans of the below-mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amounts due by them to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Sr Account No.	Loan Account No.	Type of Loan	Name of Borrowers and Co-Borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice
1	67524568 & 118503278	Loan Against Property	1. Jitendra Kumar 2. Rathod Ramilaben	31.07.2025	INR 3,73,025.47/-

Property Address : All That Piece And Parcel of Residential Property Bearing Village Authority Property No. 291, Admeasuring Area 450 Sq. Feet, Situated at Dharmashala Faiyuj Khambhali, Taluka: Mahendavd, District: Kheda, Gujarat-387130, And **Bounded As- East:** House of Fula Punja **West:** House of Atmaram Punja **North:** House of Kashiben Desai **South:** Public Road

Sr Account No.	Loan Account No.	Type of Loan	Name of Borrowers and Co-Borrowers	Section 13 (2) Notice Date	Outstanding amount as per Section 13 (2) Notice
2	140968199	Home Loan	1. Kamale Nishant Narendrabhai 2. Narendra Shantaram Kamle	23.07.2025	INR 31,49,112.40/-

Property Address : All That Piece And Parcel of The Property Bearing Flat No. 701, on the 7th Floor, Admeasuring 84.431 Sq. Mtrs. (built Up Area), Along With Undivided Share In The Land of "Jaldarshan Park of Building No. D", Situate at Revenue Survey No. 233, City Survey North No. 1800/A/28 of Moje Vyara, Ta: Vyara, Dist: Tapi, Gujarat-394650, And **Bounded As: Boundaries As Per Site: East:** Flat No. 705 **West:** Flat No. 703 **North:** Adj. Building **South:** Passage / Stair Case

You are hereby called upon to pay the amounts to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited) as per the details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under Section 13 (4) and section 14 of the SARFAESI Act, against the mortgaged properties mentioned hereinabove to realize the amount due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited). Further you are prohibited under Section 13 (13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/-
Authorized Officer
IDFC First Bank Limited

Date : 14.08.2025 (erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited and presently known as IDFC First Bank Limited)
Place : Gujarat

AMBITIOUS PLASTOMAC COMPANY LIMITED
CIN: L25200GJ1992PLC107000
Regd. Office: Office No. 703, Seventh Floor, Royal Square, Nr. R. K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad, Gujarat – 380 060, India.
Ph. No.: +91-98980 99793, E-Mail: ambitiousplasto@gmail.com,
Website: www.ambitiousplastomac.com.

STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30-JUNE-2025.

(₹ in Lakhs Except EPS)

Sl. No.	Particulars	Quarter Ended		Year Ended	
		30/06/2025 (Un-Audited)	31/03/2025 Refer Note 3 (Un-Audited)	30/06/2024 (Un-Audited)	31/03/2025 (Audited)
1.	Total Income	140.55	541.47	31.21	670.99
3.	Net Profit for the Period (before and after Tax, Exceptional and Extraordinary Items)	2.93	4.60	1.81	9.38
3.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	2.93	4.60	1.81	9.38
4.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2.47	3.13	1.81	7.91
5.	Paid-up Equity Share Capital of Face Value Rs.10/- Each	581.00	581.00	581.00	581.00
6.	Other Equity (Excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of Previous Year)				(647.73)
7.	Earnings Per Equity Share (Not Annualised): Basic Earnings Per Equity Share (Not Annualised): Diluted	0.04 0.04	0.05 0.05	0.03 0.03	0.14 0.14

Notes:

- The above un-audited financial results for the quarter ended 30-June-2025 have been reviewed & recommended by the audit committee and approved by the board of directors at their meeting held on 13-August-2025. The statutory auditors of the Company have carried out audit of aforesaid results as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015.
- This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.
- The above is an extract of the detailed format of the quarter and year ended financial results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full Format of the quarter ended financial results are available on the website of BSE Ltd. at www.bseindia.com and on the website of the Company i.e. www.ambitiousplastomac.com

For Ambitious Plastomac Company Ltd
Sd/-
Pinkal R. Patel
Managing Director
DIN: 06512030

Date: 13.08.2025
Place: Ahmedabad

muthoot HOUSING FINANCE

Registered Office: TC NO.14/2074-7, Muthoot Centre, Punnem Road, Thiruvananthapuram - 695 034,
Corporate Office: 12/A 01, 13th floor, Parinee Crescenzo, Plot No. C38 & C39, Bandra Kurla Complex-G block (East), Mumbai-400051, Email Id: authorised.officer@muthoot.com

DEMAND NOTICE

Under Section 13 (2) of The Securitisation And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002

Whereas the undersigned is the Authorised officer of Muthoot Housing Finance Company Ltd. ("MHFCL") under Securitisation And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices under Section 13(2) of the said Act, calling upon the following Borrower(s), Co-Borrower(s), Guarantor(s) to discharge in full their liability to the Company by making payment of entire outstanding including up to date interest, cost and charges within 60 days from the date of respective Notices issued and the publication of the Notice as given below and as way of alternate service upon you. As security for due repayment of the loan, the following Secured Asset (s) have been mortgaged to MHFCL by the said Borrower(s), Co-Borrower(s), Guarantor(s) respectively.

Sr. No.	Name of Borrower / Co-Borrower/ Guarantor	Date of NPA	Date of Demand notice	Total O/s Amount (Rs.) Future Interest Applicable
1	Loan Account No. MHFLCONAHM000005018295 1. ARVINDBHAI HIMUBHAI RATHOD 2. TARABEN ARVINDBHAI RATHOD	29-Jul-2025	02-Aug-2025	Rs.10,18,951.64/- (Rupees Ten Lakhs Eighteen Thousand Nine Hundred Fifty One And Paise Sixty Four Only) As on 02-Aug-2025
2	Description of Secured Asset(s) /Immovable Property (ies): Item No. 1 : ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY BEING MILKAT NO 702, ADMEASURING 33.1 X 44.51 SQ.FEET, SITUATE, BEING AND LYING AT MOUJE GANOL, TALUKA DHOLKA IN THE REGISTRATION DISTRICT AND SUB DISTRICT AHMEDABAD BOUNDED BY: EAST : ROAD WEST: ROAD NORTH: HOUSE OF ARVINDBHAI BIKHABHAI SOUTH: HOUSE OF JIVABHAI MAKWANA	29-Jul-2025	02-Aug-2025	Rs.2,06,119/- (Rupees Two Lakhs Six Thousand One Hundred Nineteen Only) As on 31-Jul-2025
3	Loan Account No. 12100115723 1. GIRISHKUMAR PRAHLADBHAI VANKAR 2. URMILABEN GIRISHBHAI VANKAR	29-Jul-2025	02-Aug-2025	Rs.19,57,264.72/- (Rupees Nineteen Lakhs Fifty Seven Thousand Two Hundred Sixty Four And Paise Seventy Two Only) As on 02-Aug-2025
4	Description of Secured Asset(s) /Immovable Property (ies): ALL THE PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEARING GRAM PANCHAYAT PROPERTY NO 1/80 AND ITS SERIAL NO 80 ADMEASURING ABOUT 65.03 SQ.MTS.LAND AREA AND CONSTRUCTION THEREON 41.24 SQ.MTRS. BUILT UP AREA IN THE AREA KNOWN AS " VANKAR VAS", SITUATE AT MOUJE VILLAGE: BORISANA, TAL.KADI.DIST: MEHSANA AND REGISTRATION SUB DISTRICT OF KADI, BOUNDED BY: EAST : ROAD WEST: VADA (OPEN SPACE) NORTH: HOUSE OF KESHABHAI JETHABHAI SOUTH: HOUSE OF BABUBHAI REVABHAI	29-Jul-2025	02-Aug-2025	Rs.3,44,867.52/- (Rupees Three Lakhs Forty Four Thousand Eight Hundred Sixty Seven and Paise Fifty four Only) As on 31-Jul-2025
5	Loan Account No. 12100004633 1. NARESH NARSHINBHAI BODANA 2. RAMILABEN NARESHBHAI NODANA ALIAS RAMILABEN NARESHBHAI BODANA 3. CHETANBHAI MAHADEVJI MARWADI (GUARANTOR)	29-Jul-2025	05-Aug-2025	Rs.3,44,867.52/- (Rupees Three Lakhs Forty Four Thousand Eight Hundred Sixty Seven and Paise Fifty four Only) As on 31-Jul-2025
6	Description of Secured Asset(s) /Immovable Property (ies): ALL THE PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEARING FLAT NO 309 ON 3RD FLOOR ADMEASURING ABOUT 45 SQ.MTRS SUPER BUILTUP AREA ALONG WITH 15 SQ.METER UNDIVIDED SHARE IN THE LAND SCHEME KNOWN AS " OM SHIV RESIDENCY" SITUATED AT LAND BEARING SITAUTED AT BLOCK NO 984/1 OF MOUJE BORISANA, TALUKA KALOL IN THE REGISTRATION DISTRICT OF GANDHINAGAR AND REGISTRATION SUB DISTRICT OF KALOL. BOUNDED BY: EAST : FLAT NO 310 WEST: FLAT NO 308 NORTH: OPEN SPACE AFTER LEAVING COAT SOUTH: FLAT NO 310	29-May-2025	05-Aug-2025	Rs.6,60,764.43/- (Rupees Six Lakhs Sixty Thousand Seven Hundred Sixty Four and Paise Forty Three Only) As on 30-Jul-2025
7	Loan Account No. 11154077499 1. RAVINDRA ADHARBHAI NAGRALE (CO -BORROWER AND LEGAL HEIRS OF DECEASED ADHARBHAI DAMUBHAI NAGRALE ALIAS ADHARBHAI DAMUBHAI NAGRADE 2. RAJESHBHAI ADHARBHAI NAGRALE ALIAS RAJESH AGHARBHAI NAGRANE ALIAS RAJESH AGHARBHAI NAGAROD (CO -BORROWER AND LEGAL HEIR OF DECEASED ADHARBHAI DAMUBHAI NAGRALE ALIAS ADHARBHAI DAMUBHAI NAGRADE	29-Jul-2025	04-Aug-2025	Rs.23,34,252.88/- (Rupees Twenty Three Lakhs Thirty Four Thousand Two Hundred Fifty Two and Paise Eighty Eight Only) As on 31-Jul-2025
8	Description of Secured Asset(s) /Immovable Property (ies): ALL THE PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEARING FLAT NO 47/3, HAVING PLOT AREA ADMEASURING 67.68 SQ.MTS ALONG WITH CONSTRUCTION THEREON GROUND FLOOR ADMEASURING ABOUT 58.52 SQ.MTS AND FIRST FLOOR ADMEASURING ABOUT 58.52 SQ.MTS, TOTAL ADMEASURING ABOUT 117.04 SQ.MTS IN THE SCHEME KNOWN AS " KRUSHNAKUNJ ", CONSTRUCTED ON THE LAND BEARING SURVEY NO 808/PAIKI PLOT NO 47 HAVING ADMEASURING 0-04-06 I.E 408 SQ.MTRS. AREA RESIDENTIAL PURPOSE NON - AGRICULTURE LAND IN THE SIM OF MOUJE VILLAGE : KALOL, TALUKA : KALOL, DIST : GANDHINAGAR IN THE DISTRICT OF GANDHINAGAR AND REGISTRATION SUB DISTRICT OF GANDHINAGAR (KALOL), BOUNDARIES : EAST BY : SR NO 806, PAKI PLOT NO 46 WEST BY : ROAD NORTH BY : ROW HOUSE NO 47/4 SOUTH BY : ROW HOUSE NO 47/2	29-Jul-2025	04-Aug-2025	Rs.4,42,533.98/- (Rupees Four Lakhs Forty Two Thousand Five Hundred Thirty Three and Paise Ninety Eight Only) As on 02-Aug-2025
9	Description of Secured Asset(s) /Immovable Property (ies): ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEARING MOJE PROPERTY NO 537, GRAM PANCHAYAT SR.NO.652 OF DADABHA NO VAS WHICH IS SITUATED IN DABHI SIM, TA UNHA & DIST. MEHSANA - 384170 AND ADMEASURING 540.00 SQ. FEET BOUNDED BY: EAST : ROAD WEST : ROAD NORTH : HOUSE OF CHAMPUJ DADAJI THAKOR SOUTH : BOURN	29-Jul-2025	04-Aug-2025	Rs.4,42,533.98/- (Rupees Four Lakhs Forty Two Thousand Five Hundred Thirty Three and Paise Ninety Eight Only) As on 02-Aug-2025

If the said Borrower, Co-Borrower(s) or Guarantor(s) fails to make payment to MHFCL as aforesaid, MHFCL shall be entitled to take possession of the secured asset mentioned above and shall take such other actions as is available to the Company in law, entirely at the risks, cost and consequences of the borrowers. The said Borrower(s), Co-Borrower(s) or Guarantor(s) are prohibited under the provision of sub section (13) of section 13 of SARFAESI Act to transfer the aforesaid Secured Asset(s), whether by way of sale, lease or otherwise referred to in the notice without prior consent of MHFCL.

Place: GUJARAT, **Date:** 14 Aug, 2025

Sd/- Authorised Officer
For Muthoot Housing Finance Company Limited

Ahmedabad

અચાનાંતરણથી આશ્ચર્યચાનાંમાં
તબીબ વધી શકે છે, જે પ્રાણીઓને
અપાવે, શારીર્ય સમસ્યાઓ અને
મુલ્યુનું કારણ બની શકે છે. આ
PCPA એક્ટનું ઉલ્લંઘન છે. અમે
પ્રાણીઓ વિનંતી કરીએ છીએ કે આ
આવેદનપત્ર એનિમલ વેલ્ફેર બોર્ડી
ઓફ ઇન્ડિયા (નેશનલ ઇન્સ્ટિટ્યુટ
ઓફ એનિમલ વેલ્ફેર,
હલરિયાજા) અને કેન્દ્રીય
હલરિયાજા) અને કેન્દ્રીય
વર્ણપર્યાવરણ, નવ અને આબોહવા
પરિવરતન મંત્રાલય (ઇન્દિરા
વર્ણપર્યાવરણ ભવન, નવી દિલ્હી)
ને તાત્કાલિક મોકલવામાં આવે.